

15 ઓક્ટોબર 2018

## તમારા વોર્ડમાં ઓક્ટોબર 22ના રોજ કોઈ પણ સ્થળે મત આપો

બ્રમ્પટન, ઓન્ટારિયો – સીટી ઓફ બ્રમ્પટન 22 ઓક્ટોબર 2018ના દિને નિર્ધારિત નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવું વધુ સરળ બનાવી રહ્યા છે. આ દિને, [લાયક મતદારો](#) પોતે નિવાસ કરતા હોય તે વોર્ડમાં કોઈ પણ મતદાનના સ્થળે મત આપી શકશે.

તમારા વોર્ડમાં રહેલ મતદાન કરવાના સ્થળોની યાદી માટે કૃપા કરીને તમારી વોટર નોટિસ જુઓ, અથવા સીટીની વેબસાઈટ પર રહેલા [ઈન્ટરએક્ટિવ નકશા](#) નો ઉપયોગ કરો: [www.brampton.ca/bramptonvotes](http://www.brampton.ca/bramptonvotes).

"બ્રમ્પટનમાં 147 મતદાન કરવાના સ્થળો છે. ઓક્ટોબર 22ના રોજ તમે જ્યારે ઘરની બહાર પડો જેમકે નાનામોટા કાર્યો પૂર્ણ કરવા, શાળામાંથી તમારા બાળકને પિક અપ કરવા, અથવા કામઝંઘા, અભ્યાસ, અથવા રમતગમત પરથી ઘરે પાછા ફરો ત્યારે એવી પૂરેપૂરી સંભાવના છે કે તમારા વોર્ડમાં તમે કોઈ મત આપવાના સ્થળથી બહુ દૂર નહીં હશો. તમારો મત કીમતી છે અને બ્રમ્પટનના ભાવિને આકાર આપવામાં મદદ કરશે, તેથી તમારા મત આપવાના આધિકારનો ઉપયોગ કરવાનું યાદ રાખશો." એવું બ્રમ્પટન મ્યુનિસિપલ ચૂંટણીના સીટી ક્લર્ક અને નિર્વાચન અધિકારી, પીટર ફ્રે એ અરજ કરી હતી.

### મુખ્ય મુદ્દાઓ

- મતદારની લાયકાત: તમારે બ્રમ્પટનમાં નિવાસ કરતા કેનેડાના નાગરિક હોવું જરૂરી છે અને મતદાનના દિને ઓછામાં ઓછી 18 વર્ષની વય હોવી જોઈએ. જો તમે બ્રમ્પટનમાં નિવાસ નહીં કરતા હો, પરંતુ તમે અથવા તમારા પતિ કે પત્ની શહેરમાં મિલકત ધરાવતા હો અથવા ભાડે આપતા હોય તો તમે મત આપવા લાયક ઠરો છો.
- ઓળખ: મત આપવાના સ્થળે આવો ત્યારે તમામ મતદારોએ તમને ટપાલમાં પ્રાપ્ત થયેલ વોટર નોટિસ અને [સ્વીકાર્ય ઓળખ પત્ર](#) અવશ્ય સાથે રાખવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવતા મતદાર હો પરંતુ ટપાલમાં વોટર નોટિસ પ્રાપ્ત ન થઈ હોય તો તમે મતદાર યાદીમાં તમે નહીં હો એવી સંભાવના છે. તમે મત આપવાના સ્થળે [સ્વીકાર્ય ઓળખ પત્ર](#) પૂરું પાડીને તમારું નામ યાદીમાં ઉમેરી શકો છો.
- [સીટીની વેબસાઈટ](#) પર પ્રોક્સિસ મતદાન પ્રક્રિયા સહિત સ્વીકાર્ય ઓળખ પત્ર, વારંવાર પૂછાતા પ્રશ્નો અને અન્ય મતદાર માહિતી ઉપલબ્ધ છે.

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિશે વિચારે છે. અમે તીક્ષ્ણ ફેકસ ધરાવવું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં શેકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી

રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા

સીટી ઓફ બ્રામ્પટન

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)